

COVID-19 સંસાધનો એવા વ્યક્તિઓ માટે કે જેમના નામના પૂરાવા નથી અથવા અનિશ્ચિત છે

જર્સી સ્ટેટ ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ઇમિગ્રેશનની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર અં / અથવા તેમની પાસે આરોગ્ય વીમો છે કે નહીં, બધા લોકો સંક્રમણથી સુરક્ષિત છે અને યોગ્ય પરીક્ષણ અને સારવાર મેળવે છે. પરીક્ષણ અને સારવાર ક્યારે અને કેવી રીતે લેવી તે વિશે તમારે કોઈ તબીબી વ્યવસાયી સાથે વાત કરવી જોઈએ. કૃપા કરીને નીચેની માહિતી ધ્યાનથી વાંચો:

શું હું COVID-19 પરીક્ષણ માટે પાત્ર છું?

- ✓ તમે ન્યૂ જર્સીના રહેવાસી હોવા જોઈએ.
- ✓ કફ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોય.
- ✓ પર પૂર્ણ કરો <https://self.covid19.nj.gov/> એ જોવા માટે કે તમારે COVID-19 પરીક્ષણની જરૂર છે. આ સાધન તમને તે જાણવામાં મદદ કરશે કે તમે અને તમારા પ્રિયજનોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે તમે શું કરી શકો છો.

તમે ક્યાં પરીક્ષણ કરાવી શકો?

- 1** પરીક્ષણ કેન્દ્ર પર જાઓ. તમારું ઘર છોડતાં પહેલાં પરીક્ષણ કેન્દ્રની જરૂરિયાતો વિશે વાંચી લો. પરીક્ષણ કેન્દ્રોની સાઇટ્સ અને જરૂરિયાતો માટે જુઓ: <https://covid19.nj.gov/faqs/nj-information/testing-information/where-are-testing-centers-in-new-jersey>
કિંમત: આ મફત છે.
- 2** ફેડરલી ક્વોલિફાઇડ હેલ્થ સેન્ટર્સ (Federally Qualified Health Centers, FQHCs). ફેડરલી ક્વોલિફાઇડ હેલ્થ સેન્ટર્સ (FQHCs) મફતમાં વીમો ન હોય એવા લોકો અને ઇમિગ્રેશનની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર Covid-19 નું પરીક્ષણ કરે છે અને તબીબી સંભાળ પૂરી પાડે છે. કૃપા કરીને તમારા સ્થાનિક ફેડરલી ક્વોલિફાઇડ હેલ્થ સેન્ટરનો સંપર્ક કરો અને અનુકૂળ સમય અને સૂચનો જાણો. ફેડરલી ક્વોલિફાઇડ હેલ્થ સેન્ટર્સ ની યાદી મેળવી શકાય છે:
<https://www.nj.gov/health/fhs/primarycare/fqhc/>.
કિંમત: આ મફત છે.
- 3** દવાખાનાં - ચેરિટી કેર કાર્યક્રમ. COVID-19 પરીક્ષણ ખર્ચ ચેરિટી કેર માટે લાયક વીમા માટે માફ કરવામાં આવશે. ચેરિટી કેર કાર્યક્રમની (Charity Care Program) માહિતી મેળવી શકો છો:
<https://www.nj.gov/health/charitycare/>. તમારી સ્થાનિક હોસ્પિટલમાં જતા પહેલાં તમારે કોઈ તબીબી પ્રદાતા સાથે વાત કરવી જોઈએ.

COVID-19 વ્યક્તિઓ માટે સંસાધનો કોણ નામના પૂરાવા વગરનું અથવા અનિશ્ચિત છે

જાહેર ચાર્જ નિયમ:

જાહેર ચાર્જ શું છે?

કેટલાક લોકો કે જેઓ ગ્રીનકાર્ડ (કાયદેસર કાયમી રહેઠાણ) અથવા યુ.એસ. માં પ્રવેશ માટે વિઝા માટે અરજી કરે છે તેઓએ "જાહેર ચાર્જ" પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. "જાહેર ચાર્જ" પરીક્ષણમાં વ્યક્તિને તે બતાવવું જરૂરી છે કે તેઓ ચોક્કસ સરકારી કાર્યક્રમો પર નિર્ભર બને તેવી સંભાવના નથી. નવી જાહેર ચાર્જ પરીક્ષણ ધ્યાનમાં લે છે: પૂરક પોષણ સહાય કાર્યક્રમ (SNAP, EBT, ફૂડ સ્ટેમ્પ્સ), ફેડરલ પબ્લિક હાઉસિંગ અને કલમ 8 સહાય, Medicaid (કટોકટી સેવાઓ સિવાય, 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓ), અને રોકડ સહાય કાર્યક્રમો (જેમ કે SSI, TANF, સામાન્ય સહાય). જો તમને કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને તમારા કાનૂની સેવાઓ પ્રદાતા સાથે તપાસ કરો.

જાહેર ચાર્જ નિયમ હોવા છતાં પણ હું પરીક્ષણ કરી શકું છું?

- ✓ હા, ઇમિગ્રેશન અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે COVID-19 સંબંધિત પરીક્ષણ, સારવાર અને નિવારક સંભાળ વ્યક્તિના જાહેર ચાર્જ વિશ્લેષણને નકારાત્મક અસર કરશે નહીં.

વધારે COVID-19 માહિતી માટે:

કૃપા કરીને ન્યૂ જર્સીના માહિતી કેન્દ્રનો સંપર્ક કરો: <https://covid19.nj.gov/>.

કોલ કરો (સામાન્ય COVID-19 પ્રશ્નો): **2-1-1** (7a-11p)

કોલ કરો (તબીબી પ્રશ્નો): **1-800-962-1253** (24/7)

NJCOVID પર ટેક્સ્ટ મેસેજ કરો **898-211** ચેતવણી મેળવવા માટે

માનસિક સ્વાસ્થ્ય હોટલાઇન: **866-202-4357** (8a-8p)

